

# India-CARICOM Foreign Ministers' Meeting

## ભારત-CARICOM વદિશ મંત્રીઓની મીટિંગ

24 સપ્ટેમ્બર, 2022

ન્યુયોરકમાં 23 સપ્ટેમ્બર 2022 નાં રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાનાં અવકાશમાં 4થી ભારત-CARICOM વદિશ મંત્રીઓની મીટિંગ યોજવામાં આવી હતી. ભારતનાં વદિશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને બેલિઝનાં વદિશી બાબતો, વદિશ વ્યાપાર અને ઈમિગ્રેશનનાં મંત્રી માનનયિ ઈમોન કોર્ટેને દ્વારા આ મીટિંગની સહ-અધ્યક્ષતા કરવામાં આવી હતી.

2. આ મીટિંગ સપ્ટેમ્બર 2019 માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાનાં અવકાશમાં CARICOM દેશોનાં નેતાઓ સાથેની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઐતહાસિક મીટિંગનું અનુસરણ હતી. આ મીટિંગમાં બાર્બાડોઝ, ડોમનિકા, બહામાસ, ગ્રેનાડા, ગુયાના, જમૈકા, સેંટ કટિસ એન્ડ નેવિસ, સેંટ વર્નિસેન્ટ એન્ડ ગ્રેનેડાઈન્સ, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, સુરિનામનાં માનનયિ વદિશ મંત્રીઓએ હાજરી આપી હતી.

3. આ મીટિંગ દરમિયાન, બન્ને પક્ષોએ ભારત અને CARICOM નાં દેશો વચ્ચેનાં સહકારમાં એકધારી પ્રગતિ પર ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ 2019 માં CARICOM નાં નેતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મીટિંગ દરમિયાન કરવામાં આવેલી જાહેરાતોનાં અમલીકરણની પણ સમીક્ષા કરી હતી.

4. બન્ને પક્ષોએ રાજદ્વારી સામેલગીરીઓ ગહન કરવા પર અને મહામારી બાદની આર્થિક રીકવરીનાં સંદર્ભમાં વ્યાપાર અને રોકાણ અને સહકાર વધારવા પર ચર્ચાઓ યોજી હતી. બન્ને પક્ષોએ CARICOM દેશોની આવશ્યકતાઓનાં આધાર પર જરૂરીયાત મુજબ બનાવેલા અને વશિષ્ઠ તાલીમ અભ્યાસક્રમો અને નષિણાંતો કાર્યરત કરવા સહિત વકાસ ભાગીદારી અને ક્ષમતા નર્શિમાણ પર પણ મનોમંથન કર્યું હતું.

5. CARICOM નેતાઓએ જીવનજરૂરી દવાઓ અને રસીઓનાં પૂરવઠા મારફત અભવિયક્ત કોવિડ 19 મહામારી દરમિયાન ભારતની અખંડતિતાનો સૂવકાર કર્યો હતો અને આભાર માન્યો હતો. બન્ને પક્ષોએ આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, પરંપરાગત ઔષધઓ, આઈટી અને ITES ક્ષમતા નર્શિમાણ, સંસ્કૃતિ અને ખેલકૂદ જેવા સહકારનાં સંભવિત ક્ષેત્રોની પણ ચર્ચા કરી હતી.

6. બન્ને પક્ષોએ આંતરરાષ્ટ્રિય મંચોમાં પ્રવર્તમાન સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ અન્ન અને ઊર્જા સુરક્ષા, આબોહવાનાં ફેરફારનો સામનો કરવો તેમ જ આફત વ્યવસ્થાપન અને પ્રતિરોધકતા જેવા વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કાર્ય કરવા સંમત થયા હતા.

7. તેઓએ ભારત અને કેરેબિયન પ્રાંત વચ્ચે મૈત્રીનાં ટકાઉ જોડાણ તરીકે સેવા બજાવવાનું ચાલું રાખનાર વશિષ્ઠ અને વાયબ્રન્ટ ભારતીય સમુદાય દ્વારા ભજવામાં આવેલી ભૂમિકા અને યોગદાનો પર પ્રકાશ પાડ્યો હતો. તેઓ લોકોનાં પરસ્પરનાં સંપર્કો અને સાંસ્કૃતિક જોડાણો વધારે મજબૂત કરવા તરફ કાર્ય કરવા સંમત

થયા હતા.

8. યોથી ભારત-CARICOM વદિશ મંત્રીઓની મીટિંગિમાં દ્વવપિક્ષીય અને વૈશ્વકિ સંદર્ભમાં તેઓનાં સંબંધો વધારે ગહન કરવા તરફની બન્ને પક્ષો તરફની કટબિદ્ધતા પર ભાર મૂક્યો હતો.

ન્યુયોર્ક

23 સપ્ટેમ્બર, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.